

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન દ્વારા વરિષ્ઠો માટેના કૅમ્પસ ઓફ લોંગ ટર્મ કેર પ્રોજેક્ટને સહાય

બ્રમ્પટન, ઓન્ટારિયો (10 માર્ચ 2021) – વરિષ્ઠોની લાંબા ગાળાની સંભાળ માટેની સહાયના મુદ્દે ગોલ્ડન એન્ડ વિલેજ ફોર દે એલ્ડર્લી (GAVE)માં એક સમાવેશિત કૅમ્પસ ઓફ કેરના બાંધકામ માટે ફ્લાઅર સિટી કમ્યુનિટી કૅમ્પસ ખાતે પાંચ એકર સુધીની જમીન પટ્ટા પર કર્મચારીગણ લઈ શકે તે માટે સિટી કાઉન્સિલે તેઓને અધિકૃતિ આપી છે.

કૅમ્પસ ઓફ કેરની ફેસિલિટીમાં બે મકાનોનો સમાવેશ થશે જેમાં અઘતન 160 પથારી ધરાવતું લોંગ ટર્મ કેર હોમ અને 140 એકમ ધરાવતું કિક્ષાયતી આવાસ એકમ હશે. વરિષ્ઠોને પોતાના ઘરમાં સુરક્ષિત અને નિરોગી રાખીને કૅમ્પસ ઓફ કેર આરોગ્ય સંભાળ પ્રણાલી પર આવતું દબાણ હળવું કરશે જેનાથી તેઓ એક જ સ્થળ પર સારી રીતે વૃદ્ધાવસ્થા વિવિધ જીવનશૈલીઓની તેમજ આરોગ્યની સહાય સાથે પસાર કરી શકશે.

પંજકૃત ચેરિટી તરીકે, GAVEનું જીવનધ્યેય વરિષ્ઠો માટે ઓન્ટારિયોની ગંભીર આવાસ જરૂરિયાતને સંબોધન કરવાનું તેમજ વરિષ્ઠો અન્ય લોકો વિષમ સાંસ્કૃતિક, વારસાગત, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ મારફતે આનંદિત, નિરોગી અને સંતોષપ્રદ જીવન જીવી શકે તે માટે સ્વતંત્ર જીવન નિર્વાહ કરી શકે અને લાંબા ગાળાની સંભાળ પૂરી પાડી શકાય તે છે.

બ્રમ્પટન સિટી કાઉન્સિલે સહુ પ્રથમ વખત 26 ફેબ્રુઆરી 2020ના રોજ 50 વર્ષની અવધિ માટે GAVE ને જમીન સમર્પિત કરવાની મંજૂરી આપી.

ઓન્ટારિયોનું લોંગ ટર્મ કેર મંત્રાલય 15,000 નવી લાંબા ગાળાની સંભાળની પથારીઓનું સર્જન કરશે જેથી લાંબા ગાળાની સંભાળ વધુ માત્રામાં મળી રહે અને હોસ્પિટલના હોલવેમાં અપાતી સારવાર સમાપ્ત કરવામાં સહાયતા મળે જે 2023માં પૂર્ણ થવાના લક્ષ્યાંક સાથે 7,000 વધુ લાંબા ગાળાની સંભાળની પથારીઓ ઉમેરીને થશે.

સુવાક્યો

"સિટી ઓફ બ્રમ્પટન આપણા વરિષ્ઠોને સહાયતા આપવા સમર્પિત છે જેમણે પોતાનું જીવન પોતાના બાળકો, પૌત્રોને સ્વતંત્રતા અને કેનેડામાં વધુ સમૃદ્ધ જીવન જીવી શકે તે માટે કુરબાની આપી. ગોલ્ડન વિલેજ ફોર દે એલ્ડર્લી જેવી સંસ્થાઓ મારફતે આપણા વરિષ્ઠો પોતાના સોનેરી દિવસો આરામ અને સલામતીથી જીવી શકે છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

"ફ્લાઅર સિટી કમ્યુનિટી કેમ્પસ પર ગોલ્ડન એજ વિલેજ ફોર દ એલ્ડર્લી માટે પટ્ટા પર જમીન લેવી તે નિદર્શિત કરે છે કે સિટી ઓફ બ્રમ્પટન લાંબા ગાળાની સંભાળને સહાયતા અને આપણા સમાજમાં વધતા જતા આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધતા ધરાવે છે. સ્થાનિક રીજનલ કાઉન્સિલર અને પીલના માનવસેવા પ્રમુખ તરીકે હું બ્રમ્પટન તરફની ગોલ્ડન વિલેજની પ્રતિબદ્ધતાનું સ્વાગત કરું છું અને મને આનંદ છે કે સિટી કાઉન્સિલે વોર્ડ 4 માં આ મહત્વપૂર્ણ આવાસ યોજના આગળ ધપાવવાની મંજૂરી આપી."

- માર્ટિન મેડિરોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, પ્રમુખ, પ્લેનિંગ એન્ડ ડેવેલપમેન્ટ, સિટી ઓફ બ્રમ્પટન, પ્રમુખ, હ્યુમન સર્વિસિસ, રિજન ઓફ પીલ

"કેમ્પસ ઓફ કેર હોવાથી આપણી આરોગ્ય સંભાળ પ્રણાલી પર રહેતો બોજો હળવો થશે કારણકે વરિષ્ઠો પોતે જેને ઘર કહી શકે એવા સ્થળે સુરક્ષિતપણે રહેશે અને નિરોગી રહેશે. આ વોર્ડમાં વરિષ્ઠો માટે અદ્યતન 160 પથારી ધરાવતું લોંગ ટર્મ કેર હોમ અને 140 એકમ ધરાવતું કિફાયતી આવાસ એકમ વોર્ડ 4 માં એક આવકાર્ય ઉમેરો છે જે સુનિશ્ચિત કરે છે કે તેઓને પોતે ઘર કહી શકે એવું કિફાયતી રહેઠાણનું સ્થળ મળી શકે."

- જેફ બોમેન, સિટી કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, સિટી ઓફ બ્રમ્પટન

"આ પરિયોજના શહેરના સૌથી સહેલાઈથી અસરગ્રસ્ત થઈ શકે એવા રહેવાસીઓને સીધી મદદ પૂરી પાડે છે અને આ કેમ્પસ ઓફ કેર ફેસિલિટીના સામાજિક-આર્થિક પ્રભાવથી બ્રમ્પટન શહેરના આર્થિક પુનર્જીવનમાં જન કુંકાશે કારણકે તેનાથી ઘણા બધા ક્ષેત્રોમાં રોજગાર ઊભો થશે જેમકે બાંધકામ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને લાંબા ગાળાની સંભાળ. અમને આ મહત્વપૂર્ણ ભાગીદારીમાં આગળ વધતા આનંદની લાગણી થાય છે જેનાથી આપણા વરિષ્ઠ સમાજમાં આવશ્યક સહાયતા આણી શકાશે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

